

# આજે જ

તમારા બચત ખાતા પર વાર્ષિક ૭.૦૦%\*  
સુધી કમાવાનું શરૂ કરો!

| બચત ખાતાના<br>વ્યાજ દરો                       |                                             |
|-----------------------------------------------|---------------------------------------------|
| નિવાસી અને બિન-નિવાસી<br>ભારતીયો માટે         |                                             |
| બચત ખાતાના<br>બેલેન્સ માટે સ્લેબ<br>(INR માં) | વ્યાજ દરો<br>(વાર્ષિક)*<br>૧૨-૧૨-૨૫ થી લાગુ |
| ૫ લાખ સુધી                                    | 2.75%                                       |
| ૫ લાખથી વધુ અને<br>૧૦ લાખ સુધી                | 5.50%                                       |
| ૧૦ લાખથી વધુ અને<br>૫૦ લાખ સુધી               | 6.00%                                       |
| ૫૦ લાખથી વધુ અને<br>૩ કરોડ સુધી               | 6.50%                                       |
| ૩ કરોડથી વધુ ૨૫ કરોડ સુધી                     | 6.75%                                       |
| ૨૫ કરોડથી વધુ અને<br>૫૦ કરોડ સુધી             | 7.00%                                       |
| ૫૦ કરોડથી વધુ અને<br>૭૫ કરોડ સુધી             | 5.00%                                       |
| ૭૫ કરોડથી વધુ                                 | 5.00%                                       |

**એસબીએમ બેંક ઇન્ડિયા**, જે ભારતની સૌથી નાની વિદેશી બેંક અને RBIના સંપૂર્ણ માલિકીની પેટાકંપની ૩૮ હેઠળની પ્રથમ યુનિવર્સલ બેંક છે, એ ભારતમાં તેની કામગીરીના 7 વર્ષ પૂર્ણ કર્યા છે. બેંક **SBM ગ્રુપ**, એક **વૈશ્વિક બેંકિંગ સમૂહ**નો ભાગ છે જે પાંચ દાયકાથી વધુ સમયથી કાર્યરત છે. SBM ગ્રુપ મોરેશિયસની એક અગ્રણી બેંકિંગ અને નાણાકીય સેવાઓ કંપની છે અને મોરેશિયસના સ્ટોક એક્સચેન્જ પર ગ્રીજુ સૌથી મોટી લિસ્ટેડ એન્ટિટી છે.